

ઈચ્છાપોરના એ.ટી.એમ.કાપી ચોરી કરતી મેવાતી ગોંગના સાગરીતને ઝડપી પાડતી,
સુરત શહેર કાઈમ બ્રાંચ.

સુરત શહેરના ઈચ્છાપોર બસ સ્ટેશન નં.૩ પાસે આવેલ કોર્પોરેશન બેન્કના ATM મશીનને ગેસ કટર વડે કાપી ATM મશીનને આશરે રૂ. ૨,૫૦,૦૦૦/- નું નુકશાન કરી ATM મશીનના ટ્રેમાંથી કુલ રોકડા રૂપિયા ૧૪,૫૧,૫૦૦ ની ચોરી કરેલ હોવા અંગેનો ગુન્હો ઈચ્છાપોર પો.સ્ટે. ૧ ગુ.ર.નં.૫૦/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૪૨૭,૧૨૦(બી) મુજબનો ગુન્હો દાખલ થયેલ જે ગુન્હા સબંધે કાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યા તથા આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા એક સફેદ કલરની અર્ટીગા કાર નંબર:HR-73-A-4553 તથા તે કારમાં આવેલ ઈસમો જે સ્થળે રોકાયેલ તે હોટલ પરથી સી.સી.ટી.વી.કુટેજ મેળવી તેનું એનાલીસીસ કરી શંકાસ્પદ ગુનામાં હરીયાણાની મેવાત ગોંગના ઈસમોની સંડોવણી હોય જે આધારે માલુમ પડેલ કે ગુન્હામાં વપરાયેલ અર્ટીગા કાર નં. HR-73-A-4553 ના મુળ માલિક વકીલ ખાનના ઘરે જઈ તપાસ કરતા તેઓએ સદર કાર સલમુદીન ઉર્ફે સલમુ શાહબુદીન તેલી (મલીક) રહે.ગામ-પિનંગવા ગલી નંબર-૩, ઈમલીવાલી મસ્જીદની પાછળ તા.પુન્હાના જી.નુહ-મેવાત (હરીયાણા) નામના ઈસમે સદર કાર તેનો નાનો ભાઈ આરોપી શાહરૂક ઉર્ફે કાલુ શાહબુદીન તેલી (મલીક) નાનો ઉપયોગ કરતો હોવાનું જણાવતા મજકુર આરોપી શાહરૂક ઉર્ફે કાલુ શાહબુદીન તેલી (મલીક) નાઓને અર્ટીગા કાર નં. HR-73-A-4553 બાબતે પુછપરછ કરી તેને સ્થાનિક પોલીસની મદદ મેળવી વધુ તપાસ અર્થે સુરત શહેર ડી.સી.બી.પો.સ્ટે. લઈ આવી મજકુર આરોપી ઈસમને પુછપરછ કરતા મજકુર ઈસમે કબુલાત કરેલ કે તા.૧૮/૦૭/૧૯ ના રોજ પીંગવા (મેવાત) પોતાના મિત્ર જુનેદ હાજર મેઉ રહે. ગાવ પિનંગવા ગલી નંબર-૧, ઈમલીવાલી મસ્જીદની પાછળ તા.પુન્હાના જી-નુહ મેવાત (હરીયાણા) તથા તેના સાથી સદામ ઈલીયાસ રહે.શીકારપુર થાના-તાવડુ જી.નુહ (મેવાત) તથા તેના મિત્ર વસીમખાન નાઓને ATM મશીન કાપી તેમાંથી રોકડ રકમ ચોરી કરવા જવા માટે એક અઠવાડીયાના સમય માટે રૂ. ૨૪.૦૦૦/- ના ભાડથી આરોપી શાહરૂકની કાર લઈ જવાની વાત કરતા પૈસાની લાલચ આવી જતા આરોપી શાહરૂકે તેઓને તેની અર્ટીગા તેની કાર નં.HR-73-A-4553 ની ભાડેથી આપેલ હોવાની હકિકત જણાવેલ જેથી મજકુરે ચોરીના ગુનાઓ આચરવા માટે પોતાની અર્ટીગા કાર નં.HR-73-A-4553 ની ઉપયોગ થનાર હોવાની જાણતો હોવા છતાં તે કાર ચોરીના ગુનામાં ઉપયોગ કરવા સારૂ આપેલ હોવાની કબુલાત કરતો હોય, જેથી તેની અર્ટીગા કાર નં.HR-73-A-4553 કિ.રૂ. ૮,૦૦,૦૦૦/-ની મત્તાની ગણી કબજે કરી સદર ગુનાના વર્કઆઉટ દરમ્યાન અર્ટીગા કારનો ઉપયોગ આરોપીઓએ મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લાના ઝુનારદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૨૫/૦૮/૧૯ ના રોજ જુદા જુદા ત્રણ ATM મશીનો ગેસ કટરથી કાપી કુલ રૂ. ૬૬,૦૦.૦૦૦/- ની ચોરી કરવામાં ઉપયોગ થયેલ જે નીચે મુજબના ગુન્હાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે.

ડીટેક્ટ થયેલ ગુન્હાઓ :- (૧) ઈચ્છાપોર પો.સ્ટે. ૧ ગુ.ર.નં. ૫૦/૧૯ ઈ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૪૨૭,૧૨૦(બી) મુજબ (૨) ઝુનારદેવ પો.સ્ટે. ૧ ગુ.ર.નં.૨૨૭/૧૯ ઈ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબ (મધ્યપ્રદેશ છીંદવાડા જિલ્લા) (૩) ઝુનારદેવ પો.સ્ટે. ૧ ગુ.ર.નં. ૨૨૮/૧૯ ઈ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબ (મધ્યપ્રદેશ છીંદવાડા જિલ્લા)